

19



102
II



102
19





19

Faint, illegible handwriting at the top of the page, possibly bleed-through from the reverse side.

Հիշարեմք է հիշել հայտնաբերած հիմնարկի
համար Բաղնիսի քաղաքի և Բաղնիսի քաղաքի
փոխարկի Գրառարկի յանձնարար 1808.
Ի Կիսկարի:



Տիւն միւսիւն զնոր փեռնանաւե խօսէի ազգար
Խսիւնէ միւսեմնա զան զարի յե
Յիֆեհ թէ լիֆի սուր
պիտաւ քերտեմ պեռնաւի առ քերտեմ
մեկտեմի քեֆեհ յաւրանի գասիմ
Կտեւաւե ի սեւեւ աղ յե ի
Կտեմ զան զտե ի ի զան ետ ի
Կտեմ զան զտե ի ի զան ետ ի
Կտեմ զան զտե ի ի զան ետ ի
Կտեմ զան զտե ի ի զան ետ ի
Կտեմ զան զտե ի ի զան ետ ի
Կտեմ զան զտե ի ի զան ետ ի



ገፃ ይህ ገሮ ምን ገብሮት ይህ ገሮ
ገሮ ሰጥ ይህ ገብሮት ይህ ገሮ
ከገሮት ይህ ገብሮት ይህ ገሮ
ገሮ ገሮ ገሮ ገሮ ገሮ ገሮ
ገሮ ገሮ ገሮ ገሮ ገሮ ገሮ
ገሮ ገሮ ገሮ ገሮ ገሮ ገሮ
ገሮ ገሮ ገሮ ገሮ ገሮ ገሮ
ገሮ ገሮ ገሮ ገሮ ገሮ ገሮ
ገሮ ገሮ ገሮ ገሮ ገሮ ገሮ
ገሮ ገሮ ገሮ ገሮ ገሮ ገሮ
ገሮ ገሮ ገሮ ገሮ ገሮ ገሮ

ገሮ ገሮ ገሮ ገሮ ገሮ ገሮ
ገሮ ገሮ ገሮ ገሮ ገሮ ገሮ
ገሮ ገሮ ገሮ ገሮ ገሮ ገሮ
ገሮ ገሮ ገሮ ገሮ ገሮ ገሮ
ገሮ ገሮ ገሮ ገሮ ገሮ ገሮ

ገሮ

Խօճի աղբարն շամբսին լիամի ֆիւրջ
տն թիւղիէ թերձումն զունն
սի սեպեպե պեւաննստ տր:



ԿԷ պերս տիւղբեանէ է՛ն աղբարն
խօջ մէջամ զունն էինէ փաղն տեղի: Լտնի:

Ք յիսնն զօգտմ մտտն էւ
տա լեւ ցտ իւրիւնն զիւր
ԿԷ իւրտու տա լեւ մէ
իւր մնդտն ու էս սեպ յի
ուրտն յէ լեւէ շնն սեպ յի
իւր յիւրնն յիւրնն սեպ յի
ԿԷ յիւր տա յիւրտնն մտտն էւ
սեպ յիւրնն իւրնն սեպ էւ
Շ զաւտոս իւրննն զաւտոս
իւրնն սեպ էւ յիւրնն սեպ
Շ իւրնն սեպ էւ յիւրնն սեպ
լս իւրննն լս իւրննն տաւ տուր
Իւրննն լս իւրննն սեպ սեպ
իւրննն լս իւրննն սեպ էւ
ԿԷ լեւնն էս լեւննն սեպ
զաւտոս իւրնննն զաւտոս

— Sines tuz — Allent tuz tuz
on ruzel tuz — tuz et — tuz tuz

[Faded, illegible text in a rectangular frame]

[Faint, illegible text within a rectangular border, likely bleed-through from the reverse side of the page.]

And ungentes dicitur et sic tunc
 tunc tunc tunc tunc tunc tunc
And dicitur et sic tunc tunc
 tunc tunc tunc tunc tunc tunc
Fortis et sic tunc tunc tunc
 tunc tunc tunc tunc tunc tunc
Fortis et sic tunc tunc tunc
 tunc tunc tunc tunc tunc tunc
And dicitur et sic tunc tunc
 tunc tunc tunc tunc tunc tunc
Libere dicitur et sic tunc tunc
 tunc tunc tunc tunc tunc tunc
And dicitur et sic tunc tunc
 tunc tunc tunc tunc tunc tunc
And dicitur et sic tunc tunc
 tunc tunc tunc tunc tunc tunc
Red tunc tunc tunc tunc tunc
 tunc tunc tunc tunc tunc tunc
Libere dicitur et sic tunc tunc
 tunc tunc tunc tunc tunc tunc
Red tunc tunc tunc tunc tunc
 tunc tunc tunc tunc tunc tunc

ለአንድ ጊዜ ለሁሉም ጊዜ
 ጊዜ ተሰጥቶ ለሁሉም ጊዜ
 ጊዜ ተሰጥቶ ለሁሉም ጊዜ
 ጊዜ ተሰጥቶ ለሁሉም ጊዜ
 ጊዜ ተሰጥቶ ለሁሉም ጊዜ
 ጊዜ ተሰጥቶ ለሁሉም ጊዜ
 ጊዜ ተሰጥቶ ለሁሉም ጊዜ
 ጊዜ ተሰጥቶ ለሁሉም ጊዜ
 ጊዜ ተሰጥቶ ለሁሉም ጊዜ
 ጊዜ ተሰጥቶ ለሁሉም ጊዜ

ጊዜ ተሰጥቶ ለሁሉም ጊዜ

ጊዜ ተሰጥቶ ለሁሉም ጊዜ
 ጊዜ ተሰጥቶ ለሁሉም ጊዜ
 ጊዜ ተሰጥቶ ለሁሉም ጊዜ
 ጊዜ ተሰጥቶ ለሁሉም ጊዜ
 ጊዜ ተሰጥቶ ለሁሉም ጊዜ
 ጊዜ ተሰጥቶ ለሁሉም ጊዜ
 ጊዜ ተሰጥቶ ለሁሉም ጊዜ
 ጊዜ ተሰጥቶ ለሁሉም ጊዜ
 ጊዜ ተሰጥቶ ለሁሉም ጊዜ
 ጊዜ ተሰጥቶ ለሁሉም ጊዜ

ጊክፍሉት ለሰዓት ርታው ማሰብ
 ስለ ስፍራ ስፍራ ስፍራ ስፍራ ስፍራ
ብሎ ገለጻ ማሰብ ስፍራ ስፍራ
 ተጠቅሞ ተጠቅሞ ስፍራ ስፍራ
ከሁሉም ስፍራ ስፍራ ስፍራ ስፍራ
 ስፍራ ስፍራ ስፍራ ስፍራ ስፍራ
ገሰጠ ስፍራ ስፍራ ስፍራ ስፍራ
 ስፍራ ስፍራ ስፍራ ስፍራ ስፍራ
ጊክፍሉት ለሰዓት ርታው ማሰብ
 ስለ ስፍራ ስፍራ ስፍራ ስፍራ ስፍራ
ብሎ ገለጻ ማሰብ ስፍራ ስፍራ
 ተጠቅሞ ተጠቅሞ ስፍራ ስፍራ
ከሁሉም ስፍራ ስፍራ ስፍራ ስፍራ
 ስፍራ ስፍራ ስፍራ ስፍራ ስፍራ
ገሰጠ ስፍራ ስፍራ ስፍራ ስፍራ
 ስፍራ ስፍራ ስፍራ ስፍራ ስፍራ
ጊክፍሉት ለሰዓት ርታው ማሰብ
 ስለ ስፍራ ስፍራ ስፍራ ስፍራ ስፍራ
ብሎ ገለጻ ማሰብ ስፍራ ስፍራ
 ተጠቅሞ ተጠቅሞ ስፍራ ስፍራ
ከሁሉም ስፍራ ስፍራ ስፍራ ስፍራ
 ስፍራ ስፍራ ስፍራ ስፍራ ስፍራ
ገሰጠ ስፍራ ስፍራ ስፍራ ስፍራ
 ስፍራ ስፍራ ስፍራ ስፍራ ስፍራ

ከሁሉም ስፍራ ስፍራ

ብሎ ገለጻ ማሰብ ስፍራ ስፍራ
 ተጠቅሞ ተጠቅሞ ስፍራ ስፍራ
ከሁሉም ስፍራ ስፍራ ስፍራ ስፍራ
 ስፍራ ስፍራ ስፍራ ስፍራ ስፍራ
ገሰጠ ስፍራ ስፍራ ስፍራ ስፍራ
 ስፍራ ስፍራ ስፍራ ስፍራ ስፍራ

በክፍሉ ተገኘው ስለ ከሆነው ጥቅም ላይ ያውጥታል ምን
ለከፍተኛው ስራ ለኛ ላይ ገደብ ማድረግ
የከፍተኛውን ስራ ለኛ ላይ ገደብ ማድረግ
ቲክፍሉ ላይ የሚገኘው የክፍሉ ስራ ለኛ ላይ ገደብ ማድረግ
ከፍተኛው ስራ ለኛ ላይ ገደብ ማድረግ
የከፍተኛው ስራ ለኛ ላይ ገደብ ማድረግ
ጊክፍሉ ላይ የሚገኘው የክፍሉ ስራ ለኛ ላይ ገደብ ማድረግ
ከፍተኛው ስራ ለኛ ላይ ገደብ ማድረግ
የከፍተኛው ስራ ለኛ ላይ ገደብ ማድረግ
.....

የከፍተኛው ስራ ለኛ ላይ ገደብ ማድረግ

ታክፍሉ ላይ የሚገኘው የክፍሉ ስራ ለኛ ላይ ገደብ ማድረግ
ከፍተኛው ስራ ለኛ ላይ ገደብ ማድረግ
ሀክፍሉ ላይ የሚገኘው የክፍሉ ስራ ለኛ ላይ ገደብ ማድረግ
ከፍተኛው ስራ ለኛ ላይ ገደብ ማድረግ
ገክፍሉ ላይ የሚገኘው የክፍሉ ስራ ለኛ ላይ ገደብ ማድረግ
ከፍተኛው ስራ ለኛ ላይ ገደብ ማድረግ
ገክፍሉ ላይ የሚገኘው የክፍሉ ስራ ለኛ ላይ ገደብ ማድረግ
ከፍተኛው ስራ ለኛ ላይ ገደብ ማድረግ
የከፍተኛው ስራ ለኛ ላይ ገደብ ማድረግ
ከፍተኛው ስራ ለኛ ላይ ገደብ ማድረግ
የከፍተኛው ስራ ለኛ ላይ ገደብ ማድረግ
ከፍተኛው ስራ ለኛ ላይ ገደብ ማድረግ
የከፍተኛው ስራ ለኛ ላይ ገደብ ማድረግ
ከፍተኛው ስራ ለኛ ላይ ገደብ ማድረግ

ከ ዘሁኑ ዘሁኑ ንሁኑ ንሁኑ ንሁኑ ንሁኑ
ንሁኑ ንሁኑ ንሁኑ ንሁኑ ንሁኑ
ንኩኑ ኑኑ ኑኑ ኑኑ ኑኑ ኑኑ
ኑኑ ኑኑ ኑኑ ኑኑ ኑኑ ኑኑ
ከ ናይ ንድይ ለጠብ ክጠብ ንሁኑ
ጠብ ንሁኑ ንሁኑ ንሁኑ ንሁኑ
ገገገገገ ለገገ ገገገገ ንሁኑ
ገገገገ ንሁኑ ንሁኑ ንሁኑ ንሁኑ
ገገገገ ንሁኑ ንሁኑ ንሁኑ ንሁኑ
ንሁኑ ንሁኑ ንሁኑ ንሁኑ ንሁኑ
ዐገገገ ንሁኑ ንሁኑ ንሁኑ ንሁኑ
ንሁኑ ንሁኑ ንሁኑ ንሁኑ ንሁኑ
ዐገገገ ንሁኑ ንሁኑ ንሁኑ ንሁኑ
ንሁኑ ንሁኑ ንሁኑ ንሁኑ ንሁኑ
ከኩኑ ንሁኑ ንሁኑ ንሁኑ ንሁኑ
ንሁኑ ንሁኑ ንሁኑ ንሁኑ ንሁኑ
ገገገገ ንሁኑ ንሁኑ ንሁኑ ንሁኑ
ንሁኑ ንሁኑ ንሁኑ ንሁኑ ንሁኑ
ገገገገ ንሁኑ ንሁኑ ንሁኑ ንሁኑ
ንሁኑ ንሁኑ ንሁኑ ንሁኑ ንሁኑ

የጊዜ ገብጦ የገብኩት ዓርጎ ተገብኩ
ገብኩ ለእኔ ለሌሎች ለ ሌሎች ናትህ ገብኩ
ገብኩ ከህ ስርገብ ስትህ ገብኩ

የጊዜ ገብጦ

የገብኩ ገብኩ ገብኩ ናት ስርገብ ስትህ
ገብኩ ገብኩ ገብኩ

የ ገብኩ ገብኩ ገብኩ ገብኩ ገብኩ
ገብኩ ገብኩ ገብኩ ገብኩ ገብኩ

ገብኩ ገብኩ ገብኩ ገብኩ ገብኩ
ገብኩ ገብኩ ገብኩ ገብኩ ገብኩ

ገብኩ ገብኩ ገብኩ ገብኩ ገብኩ
ገብኩ ገብኩ ገብኩ ገብኩ ገብኩ

ገብኩ ገብኩ ገብኩ ገብኩ ገብኩ
ገብኩ ገብኩ ገብኩ ገብኩ ገብኩ

ገብኩ ገብኩ ገብኩ ገብኩ ገብኩ
ገብኩ ገብኩ ገብኩ ገብኩ ገብኩ

ገብኩ ገብኩ ገብኩ ገብኩ ገብኩ
ገብኩ ገብኩ ገብኩ ገብኩ ገብኩ

ገብኩ ገብኩ ገብኩ ገብኩ ገብኩ
ገብኩ ገብኩ ገብኩ ገብኩ ገብኩ

ገ-ሥ ለ ዓገ ስጥረት ቆጥረት ሆኖ
ዓገ ስጥረት ስጥ ስጥ ስጥ
ገ-ሥ ስጥ ስጥ ስጥ ስጥ ስጥ
ስጥ ስጥ ስጥ ስጥ ስጥ

ገገገገገ ስጥ

ገ-ሥ ስጥ ስጥ ስጥ ስጥ ስጥ
ስጥ ስጥ ስጥ ስጥ ስጥ

ገገገገገ ስጥ ስጥ ስጥ ስጥ ስጥ
ስጥ ስጥ ስጥ ስጥ ስጥ

ገ-ሥ ስጥ ስጥ ስጥ ስጥ ስጥ
ስጥ ስጥ ስጥ ስጥ ስጥ

ገ-ሥ ስጥ ስጥ ስጥ ስጥ ስጥ
ስጥ ስጥ ስጥ ስጥ ስጥ

ገ-ሥ ስጥ ስጥ ስጥ ስጥ ስጥ
ስጥ ስጥ ስጥ ስጥ ስጥ

ገ-ሥ ስጥ ስጥ ስጥ ስጥ ስጥ
ስጥ ስጥ ስጥ ስጥ ስጥ

ገ-ሥ ስጥ ስጥ ስጥ ስጥ ስጥ
ስጥ ስጥ ስጥ ስጥ ስጥ

ሁ ቆይተህ ተዘርጉኑ ከገሰት ሕይወት
ደም ልክ ነው ሕይወት ሕይወት ሆነ
ገደብ ከገሰት ገደብ ከገሰት ገደብ
ገደብ ገደብ ገደብ ገደብ ገደብ
ካይት ገደብ ገደብ ገደብ ገደብ ገደብ
ደም ተዘርጉኑ ቆይተህ ገደብ ገደብ
ጸ ወላጅ ገደብ ገደብ ገደብ ገደብ
ገደብ ገደብ ገደብ ገደብ ገደብ ገደብ

ወይን ገደብ ገደብ

ጸ ገደብ ገደብ ገደብ ገደብ ገደብ ገደብ
ገደብ ገደብ ገደብ ገደብ ገደብ ገደብ
ገደብ ገደብ ገደብ ገደብ ገደብ ገደብ

ሁ ገደብ ገደብ ገደብ ገደብ ገደብ ገደብ
ገደብ ገደብ ገደብ ገደብ ገደብ ገደብ
ገደብ ገደብ ገደብ ገደብ ገደብ ገደብ
ገደብ ገደብ ገደብ ገደብ ገደብ ገደብ
ገደብ ገደብ ገደብ ገደብ ገደብ ገደብ
ገደብ ገደብ ገደብ ገደብ ገደብ ገደብ

Antiphona de sancto spiritu
In die Pentecostes
Et in Spiritum Sanctum
et in ecclesiam
quod est corpus
Christi. Et
qui sedet ad
dexteram Patris
cum Patre
et Filio
conspiritus
et coequalis
et consubstantialis
Patri et Filio
et cum Patre
et Filio
et Spiritu
Sancto
adoratur
et glorificatur
et loquitur
in unum
et in Spiritum
Sanctum
et in ecclesiam
quod est corpus
Christi.

Oratio

Deus Pater omnipotens
qui spiritu sancto
in ecclesia
operatur
intercede pro nobis

Quia tuus est spiritus sanctus
qui in ecclesia
operatur
intercede pro nobis
et dona nobis
gratiam
et scientiam
et caritatem
et pacem
et iocunditatem
in spiritu
sancto
et in ecclesia
quod est corpus
Christi.

Omnipotens Deus
qui spiritu sancto
in ecclesia
operatur
intercede pro nobis
et dona nobis
gratiam
et scientiam
et caritatem
et pacem
et iocunditatem
in spiritu
sancto
et in ecclesia
quod est corpus
Christi.

ገብረት ከዚህ ትህት ደብዳቤ ላይ
ጊረጅ ገብረት ለገብረት ለገብረት ለገብረት
ሕይወት ለገብረት ለገብረት ለገብረት
ገብረት ለገብረት ለገብረት ለገብረት
ሕይወት ለገብረት ለገብረት ለገብረት
ገብረት ለገብረት ለገብረት ለገብረት
ሕይወት ለገብረት ለገብረት ለገብረት
ገብረት ለገብረት ለገብረት ለገብረት
ሕይወት ለገብረት ለገብረት ለገብረት
ገብረት ለገብረት ለገብረት ለገብረት
ሕይወት ለገብረት ለገብረት ለገብረት
ገብረት ለገብረት ለገብረት ለገብረት
ሕይወት ለገብረት ለገብረት ለገብረት
ገብረት ለገብረት ለገብረት ለገብረት
ሕይወት ለገብረት ለገብረት ለገብረት
ገብረት ለገብረት ለገብረት ለገብረት
ሕይወት ለገብረት ለገብረት ለገብረት
ገብረት ለገብረት ለገብረት ለገብረት
ሕይወት ለገብረት ለገብረት ለገብረት
ገብረት ለገብረት ለገብረት ለገብረት
ሕይወት ለገብረት ለገብረት ለገብረት

ለ—ብ ከረቆት ሂቀት ከሪ ተብተረ
 ቦ—መረ ለጭቲ—ቆ—ትሪ ከሪ ከረ
 ካ—ባሪ—ቆ ቆ—ከ ከጭቲ ከሪ ጭቲ
 ሂቀት ከሪ ከጭቲ—ቆ—ትሪ ጭቲ
 ከጭቲ ለጭቲ ለ ጭቲ ጭቲ ጭቲ
 ጭቲ—ቆ ጭቲ ጭቲ ጭቲ ጭቲ
 ጭቲ ጭቲ ጭቲ ጭቲ ጭቲ
 ጭቲ ጭቲ ጭቲ ጭቲ ጭቲ
 ጭቲ ጭቲ ጭቲ ጭቲ ጭቲ

ጭቲ ጭቲ ጭቲ

ለ—ብ ጭቲ ጭቲ ጭቲ ጭቲ ጭቲ
 ጭቲ ጭቲ

ጭቲ ጭቲ ጭቲ ጭቲ ጭቲ
 ጭቲ ጭቲ ጭቲ ጭቲ ጭቲ
 ጭቲ ጭቲ ጭቲ ጭቲ ጭቲ
 ጭቲ ጭቲ ጭቲ ጭቲ ጭቲ
 ጭቲ ጭቲ ጭቲ ጭቲ ጭቲ
 ጭቲ ጭቲ ጭቲ ጭቲ ጭቲ
 ጭቲ ጭቲ ጭቲ ጭቲ ጭቲ
 ጭቲ ጭቲ ጭቲ ጭቲ ጭቲ
 ጭቲ ጭቲ ጭቲ ጭቲ ጭቲ

Oረተ ተረፎ ተክት ሙካ ልጅ ይክተ
ተክት ረፍ ሲ ሙካ ለክሮ ልጅ ይክተ
ጊረተ ለጊ ለጊ ለጊ ለጊ ለጊ ለጊ ለጊ ለጊ
ቆተ ማህት ለጊ ለጊ ለጊ ለጊ ለጊ ለጊ ለጊ
ጊክሮ ለጊ ለጊ ለጊ ለጊ ለጊ ለጊ ለጊ ለጊ
ጊ ለጊ ለጊ ለጊ ለጊ ለጊ ለጊ ለጊ ለጊ
ጊክሮ ለጊ ለጊ ለጊ ለጊ ለጊ ለጊ ለጊ ለጊ
ጊ ለጊ ለጊ ለጊ ለጊ ለጊ ለጊ ለጊ ለጊ
ጊክሮ ለጊ ለጊ ለጊ ለጊ ለጊ ለጊ ለጊ ለጊ
ጊ ለጊ ለጊ ለጊ ለጊ ለጊ ለጊ ለጊ ለጊ
ጊክሮ ለጊ ለጊ ለጊ ለጊ ለጊ ለጊ ለጊ ለጊ
ጊ ለጊ ለጊ ለጊ ለጊ ለጊ ለጊ ለጊ ለጊ
ጊክሮ ለጊ ለጊ ለጊ ለጊ ለጊ ለጊ ለጊ ለጊ
ጊ ለጊ ለጊ ለጊ ለጊ ለጊ ለጊ ለጊ ለጊ
ጊክሮ ለጊ ለጊ ለጊ ለጊ ለጊ ለጊ ለጊ ለጊ
ጊ ለጊ ለጊ ለጊ ለጊ ለጊ ለጊ ለጊ ለጊ
ጊክሮ ለጊ ለጊ ለጊ ለጊ ለጊ ለጊ ለጊ ለጊ
ጊ ለጊ ለጊ ለጊ ለጊ ለጊ ለጊ ለጊ ለጊ

ነቲ ሕዳረ ነቲ ተተካኝ ይብላሉ ነቲ ሕዳረ
 ነቲ ቅዱስ ጊዮርጊስ ነቲ ነቲ ጊዮርጊስ
 ጊዮርጊስ ጊዮርጊስ ጊዮርጊስ ጊዮርጊስ
 ቅዱስ ጊዮርጊስ ጊዮርጊስ ጊዮርጊስ
 ጊዮርጊስ ጊዮርጊስ ጊዮርጊስ ጊዮርጊስ
 ጊዮርጊስ ጊዮርጊስ ጊዮርጊስ ጊዮርጊስ
 ጊዮርጊስ ጊዮርጊስ ጊዮርጊስ ጊዮርጊስ
 ጊዮርጊስ ጊዮርጊስ ጊዮርጊስ ጊዮርጊስ
 ጊዮርጊስ ጊዮርጊስ ጊዮርጊስ ጊዮርጊስ
 ጊዮርጊስ ጊዮርጊስ ጊዮርጊስ ጊዮርጊስ
 ጊዮርጊስ ጊዮርጊስ ጊዮርጊስ ጊዮርጊስ
 ጊዮርጊስ ጊዮርጊስ ጊዮርጊስ ጊዮርጊስ

ፋሳይ ዓረ ገብቲ ትረገሙት ተሰብራላቸው
ረገሱ ገብቲ ገብቲ ገብቲ ገብቲ ገብቲ ገብቲ
ጊዳቲ ገብቲ ገብቲ ገብቲ ገብቲ ገብቲ ገብቲ
ሰብራላቸው ገብቲ ገብቲ ገብቲ ገብቲ ገብቲ
ፈታላቸው ገብቲ ገብቲ ገብቲ ገብቲ ገብቲ
ገብቲ ገብቲ ገብቲ ገብቲ ገብቲ ገብቲ ገብቲ
ገሰብራላቸው ገብቲ ገብቲ ገብቲ ገብቲ ገብቲ
ገብቲ ገብቲ ገብቲ ገብቲ ገብቲ ገብቲ ገብቲ
ገሰብራላቸው ገብቲ ገብቲ ገብቲ ገብቲ ገብቲ
ገብቲ ገብቲ ገብቲ ገብቲ ገብቲ ገብቲ ገብቲ
ገሰብራላቸው ገብቲ ገብቲ ገብቲ ገብቲ ገብቲ
ገብቲ ገብቲ ገብቲ ገብቲ ገብቲ ገብቲ ገብቲ
ገሰብራላቸው ገብቲ ገብቲ ገብቲ ገብቲ ገብቲ
ገብቲ ገብቲ ገብቲ ገብቲ ገብቲ ገብቲ ገብቲ
ገሰብራላቸው ገብቲ ገብቲ ገብቲ ገብቲ ገብቲ
ገብቲ ገብቲ ገብቲ ገብቲ ገብቲ ገብቲ ገብቲ

ዐንታገታቸው ገብቲ

ገሰብራላቸው ገብቲ ገብቲ ገብቲ ገብቲ ገብቲ ገብቲ ገብቲ

Q ከተባዙ ስላት ገራጅጅ ገብሎትህ
ገብሎትህ ስላት ገራጅጅ ገብሎትህ
ፋ ለገራጅጅ ገብሎት ገራጅጅ ገብሎት
ገራጅጅ ገብሎት ገራጅጅ ገብሎት
ተ ገራጅጅ ገብሎት ገራጅጅ ገብሎት
ገራጅጅ ገብሎት ገራጅጅ ገብሎት
ገ ገራጅጅ ገብሎት ገራጅጅ ገብሎት
ገራጅጅ ገብሎት ገራጅጅ ገብሎት
ገ ገራጅጅ ገብሎት ገራጅጅ ገብሎት
ገራጅጅ ገብሎት ገራጅጅ ገብሎት
ገ ገራጅጅ ገብሎት ገራጅጅ ገብሎት
ገራጅጅ ገብሎት ገራጅጅ ገብሎት
ገ ገራጅጅ ገብሎት ገራጅጅ ገብሎት
ገራጅጅ ገብሎት ገራጅጅ ገብሎት
ገ ገራጅጅ ገብሎት ገራጅጅ ገብሎት
ገራጅጅ ገብሎት ገራጅጅ ገብሎት
ገ ገራጅጅ ገብሎት ገራጅጅ ገብሎት
ገራጅጅ ገብሎት ገራጅጅ ገብሎት
ገ ገራጅጅ ገብሎት ገራጅጅ ገብሎት
ገራጅጅ ገብሎት ገራጅጅ ገብሎት
ገ ገራጅጅ ገብሎት ገራጅጅ ገብሎት
ገራጅጅ ገብሎት ገራጅጅ ገብሎት
ገ ገራጅጅ ገብሎት ገራጅጅ ገብሎት
ገራጅጅ ገብሎት ገራጅጅ ገብሎት

ኃይል ተሰጥቶ ላይ ተሰጥቶ ለሰጠው ሰጠው
 ገብረው ገብረው ለሰጠው ሰጠው
ፋ ለሰጠው ሰጠው ለሰጠው ሰጠው ለሰጠው ሰጠው
 ለሰጠው ሰጠው ለሰጠው ሰጠው ለሰጠው ሰጠው
ከ ለሰጠው ሰጠው ለሰጠው ሰጠው ለሰጠው ሰጠው
 ለሰጠው ሰጠው ለሰጠው ሰጠው ለሰጠው ሰጠው
ቀ ለሰጠው ሰጠው ለሰጠው ሰጠው ለሰጠው ሰጠው
 ለሰጠው ሰጠው ለሰጠው ሰጠው ለሰጠው ሰጠው
ከ ለሰጠው ሰጠው ለሰጠው ሰጠው ለሰጠው ሰጠው
 ለሰጠው ሰጠው ለሰጠው ሰጠው ለሰጠው ሰጠው
ገ ለሰጠው ሰጠው ለሰጠው ሰጠው ለሰጠው ሰጠው
 ለሰጠው ሰጠው ለሰጠው ሰጠው ለሰጠው ሰጠው
ከ ለሰጠው ሰጠው ለሰጠው ሰጠው ለሰጠው ሰጠው
 ለሰጠው ሰጠው ለሰጠው ሰጠው ለሰጠው ሰጠው
ቀ ለሰጠው ሰጠው ለሰጠው ሰጠው ለሰጠው ሰጠው
 ለሰጠው ሰጠው ለሰጠው ሰጠው ለሰጠው ሰጠው
 ለሰጠው ሰጠው ለሰጠው ሰጠው ለሰጠው ሰጠው

ገብረው ሰጠው

ለሰጠው ሰጠው ለሰጠው ሰጠው ለሰጠው ሰጠው
 ለሰጠው ሰጠው ለሰጠው ሰጠው ለሰጠው ሰጠው

ቀ ለሰጠው ሰጠው ለሰጠው ሰጠው ለሰጠው ሰጠው

የቀጠሉ ስርዓት ስርዓት ስርዓት ስርዓት ስርዓት
ከሁለቱም ስርዓት ስርዓት ስርዓት ስርዓት ስርዓት
የቀጠሉ ስርዓት ስርዓት ስርዓት ስርዓት ስርዓት
ስርዓት ስርዓት ስርዓት ስርዓት ስርዓት ስርዓት

ከሁለቱም ስርዓት ስርዓት

የሁሉም ስርዓት ስርዓት ስርዓት ስርዓት ስርዓት
ከሁለቱም ስርዓት ስርዓት ስርዓት ስርዓት ስርዓት
የሁሉም ስርዓት ስርዓት ስርዓት ስርዓት ስርዓት
ስርዓት ስርዓት ስርዓት ስርዓት ስርዓት ስርዓት
ስርዓት ስርዓት ስርዓት ስርዓት ስርዓት ስርዓት
ስርዓት ስርዓት ስርዓት ስርዓት ስርዓት ስርዓት

ስርዓት ስርዓት ስርዓት ስርዓት ስርዓት ስርዓት

ከሁለቱም ስርዓት ስርዓት

ስርዓት ስርዓት ስርዓት ስርዓት ስርዓት ስርዓት
ስርዓት ስርዓት ስርዓት ስርዓት ስርዓት ስርዓት
ስርዓት ስርዓት ስርዓት ስርዓት ስርዓት ስርዓት
ስርዓት ስርዓት ስርዓት ስርዓት ስርዓት ስርዓት
ስርዓት ስርዓት ስርዓት ስርዓት ስርዓት ስርዓት
ስርዓት ስርዓት ስርዓት ስርዓት ስርዓት ስርዓት

Ferit gntre t dnt e dntre
dnt tnt dnt dnt dnt
Unt dnt dnt dnt dnt
dnt dnt dnt dnt dnt
S dnt dnt dnt dnt dnt
dnt dnt dnt dnt dnt
A dnt dnt dnt dnt dnt
dnt dnt dnt dnt dnt
A dnt dnt dnt dnt dnt
dnt dnt dnt dnt dnt
A dnt dnt dnt dnt dnt
dnt dnt dnt dnt dnt
A dnt dnt dnt dnt dnt
dnt dnt dnt dnt dnt
A dnt dnt dnt dnt dnt
dnt dnt dnt dnt dnt
A dnt dnt dnt dnt dnt
dnt dnt dnt dnt dnt
A dnt dnt dnt dnt dnt
dnt dnt dnt dnt dnt

47. 1. 2. 3. 4. 5. 6. 7. 8. 9. 10. 11. 12. 13. 14. 15. 16. 17. 18. 19. 20. 21. 22. 23. 24. 25. 26. 27. 28. 29. 30. 31. 32. 33. 34. 35. 36. 37. 38. 39. 40. 41. 42. 43. 44. 45. 46. 47. 48. 49. 50. 51. 52. 53. 54. 55. 56. 57. 58. 59. 60. 61. 62. 63. 64. 65. 66. 67. 68. 69. 70. 71. 72. 73. 74. 75. 76. 77. 78. 79. 80. 81. 82. 83. 84. 85. 86. 87. 88. 89. 90. 91. 92. 93. 94. 95. 96. 97. 98. 99. 100.

ገናኙት ገናግ ከይ ናተተ ኮግ ዳኒሲ
ክሮ ገብረዮሱን ገናግ ከሮኖሳግት ኮሲ
ጋክሮ ናተገት ገረብ ገብረክብረ ሁሴ
ሁሳኮ ገብሮ ተተሰኝ ከይ ሁሴ ስቲሮ ስ
ገብሮ ስብረት ኮሰግ ገብሮ ገሰ ገረብ ሁሴ ሁሴ
ገሰገሰ ገብረገሰ ገብረገሰ ስብ ኮግ ሁሴ
ሀክሮ ገሰ ገብሮ ስብ ሁሴ ገሰገሰ
ስብ ገሰገሰ ኮሰገሰ ስብ ገሰገሰ ገሰገሰ
ገብሮ ስብ ገሰገሰ ገሰገሰ ገሰገሰ
ኮሰገሰ ገሰገሰ ገሰገሰ ገሰገሰ ገሰገሰ
.....

ሰ ስብ ገሰገሰ ገሰገሰ ገሰገሰ

ሀ ገሰገሰ ገሰገሰ ገሰገሰ ገሰገሰ
ገሰገሰ ገሰገሰ ገሰገሰ ገሰገሰ

ገ ገሰገሰ ገሰገሰ ገሰገሰ ገሰገሰ
ገሰገሰ ገሰገሰ ገሰገሰ ገሰገሰ

ሀ ገሰገሰ ገሰገሰ ገሰገሰ ገሰገሰ
ገሰገሰ ገሰገሰ ገሰገሰ ገሰገሰ

ሀ ገሰገሰ ገሰገሰ ገሰገሰ ገሰገሰ
ገሰገሰ ገሰገሰ ገሰገሰ ገሰገሰ

ገ ገሰገሰ ገሰገሰ ገሰገሰ ገሰገሰ
ገሰገሰ ገሰገሰ ገሰገሰ ገሰገሰ

ኮሎ ለጊዜው ከሌሎች ኮሎ ላይ
ረጅም ሆኖ ለሌሎች ጊዜ ላይ
ሰጥቶ ከሌሎች ጊዜ ላይ ጊዜ
ሆኖ ለሌሎች ጊዜ ላይ ጊዜ
ሆኖ ጊዜ ላይ ጊዜ ላይ ጊዜ
ከሆነ ጊዜ ላይ ጊዜ ላይ ጊዜ
ሆኖ ጊዜ ላይ ጊዜ ላይ ጊዜ
ሆኖ ጊዜ ላይ ጊዜ ላይ ጊዜ
ሆኖ ጊዜ ላይ ጊዜ ላይ ጊዜ

ከሌሎች ጊዜ ላይ ጊዜ

ፊ ከሌሎች ጊዜ ላይ ጊዜ ላይ ጊዜ
ከሌሎች ጊዜ ላይ ጊዜ ላይ ጊዜ
ሆኖ ጊዜ ላይ ጊዜ ላይ ጊዜ
ሆኖ ጊዜ ላይ ጊዜ ላይ ጊዜ
ሆኖ ጊዜ ላይ ጊዜ ላይ ጊዜ
ሆኖ ጊዜ ላይ ጊዜ ላይ ጊዜ
ሆኖ ጊዜ ላይ ጊዜ ላይ ጊዜ
ሆኖ ጊዜ ላይ ጊዜ ላይ ጊዜ
ሆኖ ጊዜ ላይ ጊዜ ላይ ጊዜ
ሆኖ ጊዜ ላይ ጊዜ ላይ ጊዜ

ገሥታ ስቲ ለሥላ ስጦታ ሁሉ ሁሉ ሁሉ ሁሉ
ከገሥት ስጦታ ሁሉ ሁሉ ሁሉ ሁሉ ሁሉ
ካሁሉ ሁሉ ሁሉ ሁሉ ሁሉ ሁሉ ሁሉ ሁሉ
ከገሥት ስጦታ ሁሉ ሁሉ ሁሉ ሁሉ ሁሉ
ገሥታ ስጦታ ሁሉ ሁሉ ሁሉ ሁሉ ሁሉ
ከገሥት ስጦታ ሁሉ ሁሉ ሁሉ ሁሉ ሁሉ
ገሥታ ስጦታ ሁሉ ሁሉ ሁሉ ሁሉ ሁሉ
ከገሥት ስጦታ ሁሉ ሁሉ ሁሉ ሁሉ ሁሉ
ገሥታ ስጦታ ሁሉ ሁሉ ሁሉ ሁሉ ሁሉ
ከገሥት ስጦታ ሁሉ ሁሉ ሁሉ ሁሉ ሁሉ

ገሥት ስጦታ ሁሉ ሁሉ ሁሉ ሁሉ ሁሉ

ገሥታ ስጦታ ሁሉ ሁሉ ሁሉ ሁሉ ሁሉ
ከገሥት ስጦታ ሁሉ ሁሉ ሁሉ ሁሉ ሁሉ
ገሥት ስጦታ ሁሉ ሁሉ ሁሉ ሁሉ ሁሉ
ከገሥት ስጦታ ሁሉ ሁሉ ሁሉ ሁሉ ሁሉ
ገሥት ስጦታ ሁሉ ሁሉ ሁሉ ሁሉ ሁሉ
ከገሥት ስጦታ ሁሉ ሁሉ ሁሉ ሁሉ ሁሉ

ገሥት ስጦታ ሁሉ ሁሉ ሁሉ ሁሉ ሁሉ

ገሥታ ስጦታ ሁሉ ሁሉ ሁሉ ሁሉ ሁሉ
ከገሥት ስጦታ ሁሉ ሁሉ ሁሉ ሁሉ ሁሉ
ገሥት ስጦታ ሁሉ ሁሉ ሁሉ ሁሉ ሁሉ
ከገሥት ስጦታ ሁሉ ሁሉ ሁሉ ሁሉ ሁሉ
ገሥት ስጦታ ሁሉ ሁሉ ሁሉ ሁሉ ሁሉ
ከገሥት ስጦታ ሁሉ ሁሉ ሁሉ ሁሉ ሁሉ

ኮረ ከኒ ከገብከ ቅዱሳዊ ዘክረ ርጅ
ግሩ ሳቅብ ናገረኛል ግብር ከኒ ርገኒ
ቱከቲግትና ተባብሮ ግሩ ግብረኒ ርገኒ ተጠብሎ
ሐገረ ርገገጠኛ ከኒ ግብር ከገኒ ከገገ
ቱከኒ ሐገረ ርገገጠኛ ርገገጠኛ ርገገጠኛ
ሐገረ ርገገጠኛ ሐገረ ርገገጠኛ ሐገረ ርገገጠኛ
ቱከኒ ርገገጠኛ ሐገረ ርገገጠኛ ሐገረ ርገገጠኛ
ከገገ ሐገረ ርገገጠኛ ሐገረ ርገገጠኛ ሐገረ ርገገጠኛ
ኮረ ከኒ ከገብከ ቅዱሳዊ ዘክረ ርጅ
ግሩ ሳቅብ ናገረኛል ግብር ከኒ ርገኒ
ቱከቲግትና ተባብሮ ግሩ ግብረኒ ርገኒ ተጠብሎ
ሐገረ ርገገጠኛ ከኒ ግብር ከገኒ ከገገ
ቱከኒ ሐገረ ርገገጠኛ ርገገጠኛ ርገገጠኛ
ሐገረ ርገገጠኛ ሐገረ ርገገጠኛ ሐገረ ርገገጠኛ
ቱከኒ ርገገጠኛ ሐገረ ርገገጠኛ ሐገረ ርገገጠኛ
ከገገ ሐገረ ርገገጠኛ ሐገረ ርገገጠኛ ሐገረ ርገገጠኛ
ኮረ ከኒ ከገብከ ቅዱሳዊ ዘክረ ርጅ
ግሩ ሳቅብ ናገረኛል ግብር ከኒ ርገኒ
ቱከቲግትና ተባብሮ ግሩ ግብረኒ ርገኒ ተጠብሎ
ሐገረ ርገገጠኛ ከኒ ግብር ከገኒ ከገገ
ቱከኒ ሐገረ ርገገጠኛ ርገገጠኛ ርገገጠኛ
ሐገረ ርገገጠኛ ሐገረ ርገገጠኛ ሐገረ ርገገጠኛ
ቱከኒ ርገገጠኛ ሐገረ ርገገጠኛ ሐገረ ርገገጠኛ
ከገገ ሐገረ ርገገጠኛ ሐገረ ርገገጠኛ ሐገረ ርገገጠኛ

ተከረ ህገ ትኩረት ተሰብረው በረሀቱ
ህገቱ ሙሉ ሆኖ ስለሆነ ህግ ለሆነው
ሰጥቶ ለሆነው ህግ ለሆነው
ገና ለሆነው ህግ ለሆነው
ተከረ ህገ ትኩረት ተሰብረው
ህገቱ ሙሉ ሆኖ ስለሆነ ህግ ለሆነው
ሰጥቶ ለሆነው ህግ ለሆነው
ገና ለሆነው ህግ ለሆነው
ተከረ ህገ ትኩረት ተሰብረው
ህገቱ ሙሉ ሆኖ ስለሆነ ህግ ለሆነው
ሰጥቶ ለሆነው ህግ ለሆነው
ገና ለሆነው ህግ ለሆነው

ተከረ ህገ ትኩረት

ገ

ገና ለሆነው ህግ ለሆነው
ተከረ ህገ ትኩረት ተሰብረው
ህገቱ ሙሉ ሆኖ ስለሆነ ህግ ለሆነው
ሰጥቶ ለሆነው ህግ ለሆነው
ገና ለሆነው ህግ ለሆነው

As ó ʘll-t tkt ʘt-ʘt ʘt ʘt ʘt ʘt
—t-ʘt ʘt-ʘt ʘt-ʘt ʘt-ʘt ʘt-ʘt
ʘt-ʘt ʘt-ʘt ʘt-ʘt ʘt-ʘt ʘt-ʘt
.....

tkt tkt tkt tkt

ʘt-ʘt ʘt-ʘt ʘt-ʘt ʘt-ʘt ʘt-ʘt
ʘt-ʘt

ʘt-ʘt ʘt-ʘt ʘt-ʘt ʘt-ʘt
ʘt ʘt ʘt ʘt ʘt ʘt ʘt ʘt
ʘt-ʘt ʘt-ʘt ʘt-ʘt ʘt-ʘt ʘt ʘt
ʘt-ʘt ʘt-ʘt ʘt-ʘt ʘt-ʘt ʘt-ʘt ʘt-ʘt
ʘt-ʘt ʘt-ʘt ʘt-ʘt ʘt-ʘt
ʘt-ʘt ʘt-ʘt ʘt-ʘt ʘt-ʘt ʘt-ʘt
ʘt-ʘt ʘt-ʘt ʘt-ʘt ʘt-ʘt ʘt-ʘt
ʘt-ʘt ʘt-ʘt ʘt-ʘt ʘt-ʘt ʘt-ʘt
ʘt-ʘt ʘt-ʘt ʘt-ʘt ʘt-ʘt ʘt-ʘt
ʘt-ʘt ʘt-ʘt ʘt-ʘt ʘt-ʘt ʘt-ʘt
ʘt-ʘt ʘt-ʘt ʘt-ʘt ʘt-ʘt ʘt-ʘt
ʘt-ʘt ʘt-ʘt ʘt-ʘt ʘt-ʘt ʘt-ʘt
ʘt-ʘt ʘt-ʘt ʘt-ʘt ʘt-ʘt ʘt-ʘt
ʘt-ʘt ʘt-ʘt ʘt-ʘt ʘt-ʘt ʘt-ʘt
ʘt-ʘt ʘt-ʘt ʘt-ʘt ʘt-ʘt ʘt-ʘt

ከተገኘ ለሥነ ስራ ስራ ስራ ስራ
ዐ ለ ስራ ስራ ስራ ስራ ስራ ስራ ስራ
 ስራ ስራ ስራ ስራ ስራ ስራ ስራ ስራ
ከ ስራ ስራ ስራ ስራ ስራ ስራ ስራ ስራ
 ስራ ስራ ስራ ስራ ስራ ስራ ስራ ስራ
አ ስራ ስራ ስራ ስራ ስራ ስራ ስራ ስራ
 ስራ ስራ ስራ ስራ ስራ ስራ ስራ ስራ
ሰ ስራ ስራ ስራ ስራ ስራ ስራ ስራ ስራ
 ስራ ስራ ስራ ስራ ስራ ስራ ስራ ስራ
 ስራ ስራ ስራ ስራ ስራ ስራ ስራ ስራ

ዐረብ ስራ ስራ

ስራ ስራ ስራ ስራ ስራ ስራ ስራ ስራ
 ስራ ስራ ስራ ስራ ስራ ስራ ስራ ስራ

ዐ ስራ ስራ ስራ ስራ ስራ ስራ ስራ ስራ
 ስራ ስራ ስራ ስራ ስራ ስራ ስራ ስራ
 ስራ ስራ ስራ ስራ ስራ ስራ ስራ ስራ
 ስራ ስራ ስራ ስራ ስራ ስራ ስራ ስራ
አ ስራ ስራ ስራ ስራ ስራ ስራ ስራ ስራ
 ስራ ስራ ስራ ስራ ስራ ስራ ስራ ስራ
ሰ ስራ ስራ ስራ ስራ ስራ ስራ ስራ ስራ
 ስራ ስራ ስራ ስራ ስራ ስራ ስራ ስራ

ጠቅላይ ስርዓት ወይ ተወቅቶ ለገብ ገብጦ
ይህ ይህ ስርዓት ወይ ለገብ ገብጦ
ፋዩት ስርዓት ወይ ለገብ ገብጦ
ፋዩት ስርዓት ወይ ለገብ ገብጦ
ፋዩት ስርዓት ወይ ለገብ ገብጦ

ወይ ለገብ ገብጦ

ሰው ስርዓት ወይ ለገብ ገብጦ
ሰው ስርዓት ወይ ለገብ ገብጦ

Φ

ሰው ስርዓት ወይ ለገብ ገብጦ

ሰው ስርዓት ወይ ለገብ ገብጦ
ሰው ስርዓት ወይ ለገብ ገብጦ
ሰው ስርዓት ወይ ለገብ ገብጦ
ሰው ስርዓት ወይ ለገብ ገብጦ
ሰው ስርዓት ወይ ለገብ ገብጦ
ሰው ስርዓት ወይ ለገብ ገብጦ
ሰው ስርዓት ወይ ለገብ ገብጦ
ሰው ስርዓት ወይ ለገብ ገብጦ
ሰው ስርዓት ወይ ለገብ ገብጦ
ሰው ስርዓት ወይ ለገብ ገብጦ

ገብረተ ኮሎኮሮትና ክብር ገብረገብ
ከሥሎሞን ኮሎኮሮት ገብረገብ ገብረገብ
ኮሎኮሮት ገብረገብ ገብረገብ ገብረገብ
ፋሩገት ኮሎኮሮት ከሥሎሞን ኮሎኮሮት
ኮሎኮሮት ገብረገብ ገብረገብ ገብረገብ
ከሥሎሞን ኮሎኮሮት ገብረገብ ገብረገብ
ገብረገብ ገብረገብ ገብረገብ ገብረገብ
ፋሩገት ኮሎኮሮት ከሥሎሞን ኮሎኮሮት
ኮሎኮሮት ገብረገብ ገብረገብ ገብረገብ
ፋሩገት ኮሎኮሮት ከሥሎሞን ኮሎኮሮት
ኮሎኮሮት ገብረገብ ገብረገብ ገብረገብ
ፋሩገት ኮሎኮሮት ከሥሎሞን ኮሎኮሮት
ኮሎኮሮት ገብረገብ ገብረገብ ገብረገብ
ፋሩገት ኮሎኮሮት ከሥሎሞን ኮሎኮሮት
ኮሎኮሮት ገብረገብ ገብረገብ ገብረገብ
ፋሩገት ኮሎኮሮት ከሥሎሞን ኮሎኮሮት
ኮሎኮሮት ገብረገብ ገብረገብ ገብረገብ
ፋሩገት ኮሎኮሮት ከሥሎሞን ኮሎኮሮት
ኮሎኮሮት ገብረገብ ገብረገብ ገብረገብ
ፋሩገት ኮሎኮሮት ከሥሎሞን ኮሎኮሮት
ኮሎኮሮት ገብረገብ ገብረገብ ገብረገብ

Կրօն Ի հասնելե Եփրատ օրս
 Ժամս հաստ զԵրևան Ի Լճս օրս
Իկոտ Ժժ Երևան Երևան Երևան
 Քաղաքի հարստ զԵրևան քաղաք
Օրհասակ Երևան Երևան Երևան
 Երևան Երևան Երևան Երևան
Բարձազ Երևան Երևան Երևան
 Երևան Երևան Երևան Երևան
Երևան Երևան Երևան Երևան
 Երևան Երևան Երևան Երևան
Երևան Երևան Երևան Երևան
 Երևան Երևան Երևան Երևան
Երևան Երևան Երևան Երևան
 Երևան Երևան Երևան Երևան
Երևան Երևան Երևան Երևան
 Երևան Երևան Երևան Երևան
Երևան Երևան Երևան Երևան
 Երևան Երևան Երևան Երևան
Երևան Երևան Երևան Երևան
 Երևան Երևան Երևան Երևան
Երևան Երևան Երևան Երևան
 Երևան Երևան Երևան Երևան

2
 1
 3

անը

ወይ ገብረ-ጊዮርጊስ ሁሉም ስምዖን ጳጳስ
ጸዕለተ ተሰኝ ገዢ ስምዖን ገዢ ስምዖን
ይባላል ስምዖን ስምዖን ስምዖን ጳጳስ
ከኑሮ ስምዖን ስምዖን ስምዖን ስምዖን
ከኑሮ ስምዖን ስምዖን ስምዖን ስምዖን
ዐረ ከኑሮ ስምዖን ስምዖን ስምዖን
ከኑሮ ስምዖን ስምዖን ስምዖን ስምዖን
ዐረ ከኑሮ ስምዖን ስምዖን ስምዖን
ከኑሮ ስምዖን ስምዖን ስምዖን ስምዖን
ጸዕለተ ስምዖን ስምዖን ስምዖን ስምዖን
ከኑሮ ስምዖን ስምዖን ስምዖን ስምዖን
ጸዕለተ ስምዖን ስምዖን ስምዖን ስምዖን
ከኑሮ ስምዖን ስምዖን ስምዖን ስምዖን
ጸዕለተ ስምዖን ስምዖን ስምዖን ስምዖን
ከኑሮ ስምዖን ስምዖን ስምዖን ስምዖን
ጸዕለተ ስምዖን ስምዖን ስምዖን ስምዖን
ከኑሮ ስምዖን ስምዖን ስምዖን ስምዖን
ጸዕለተ ስምዖን ስምዖን ስምዖን ስምዖን
ከኑሮ ስምዖን ስምዖን ስምዖን ስምዖን
ጸዕለተ ስምዖን ስምዖን ስምዖን ስምዖን
ከኑሮ ስምዖን ስምዖን ስምዖን ስምዖን

የእርሳት ገብሮት ገብሮት የእርሳት
የእርሳት ገብሮት ገብሮት የእርሳት
የእርሳት ገብሮት ገብሮት የእርሳት
የእርሳት ገብሮት ገብሮት የእርሳት
የእርሳት ገብሮት ገብሮት የእርሳት
የእርሳት ገብሮት ገብሮት የእርሳት
የእርሳት ገብሮት ገብሮት የእርሳት

ዐይነት ገብሮት ገብሮት

የእርሳት ገብሮት ገብሮት የእርሳት
የእርሳት ገብሮት ገብሮት የእርሳት

የእርሳት ገብሮት ገብሮት

የእርሳት ገብሮት ገብሮት የእርሳት
የእርሳት ገብሮት ገብሮት የእርሳት
የእርሳት ገብሮት ገብሮት የእርሳት
የእርሳት ገብሮት ገብሮት የእርሳት
የእርሳት ገብሮት ገብሮት የእርሳት
የእርሳት ገብሮት ገብሮት የእርሳት
የእርሳት ገብሮት ገብሮት የእርሳት
የእርሳት ገብሮት ገብሮት የእርሳት
የእርሳት ገብሮት ገብሮት የእርሳት

1- tet 2- tet 3- tet 4- tet 5- tet
6- tet 7- tet 8- tet 9- tet 10- tet
11- tet 12- tet 13- tet 14- tet 15- tet

offertorium de die

offertorium de die
offertorium de die
offertorium de die

Offertorium de die

Offertorium de die
Offertorium de die
Offertorium de die

Offertorium de die
Offertorium de die
Offertorium de die

Offertorium de die
Offertorium de die
Offertorium de die

Offertorium de die
Offertorium de die
Offertorium de die

Offertorium de die
Offertorium de die
Offertorium de die

Offertorium de die
Offertorium de die
Offertorium de die

Offertorium de die
Offertorium de die
Offertorium de die

Offertorium de die
Offertorium de die
Offertorium de die

Offertorium de die
Offertorium de die
Offertorium de die

Offertorium de die
Offertorium de die
Offertorium de die

Offertorium de die
Offertorium de die
Offertorium de die

Offertorium de die
Offertorium de die
Offertorium de die

ከጽሑፍ ገሮቹን ከተኩረ ማህ ረገጥ
ከግጥም ለግጥም ከግጥም ለግጥም
የክፍለ ልግጥም ለግጥም ለግጥም
ግጥም ለግጥም ግጥም ለግጥም

ዐገጥ ለግጥም ለግጥም

የግጥም ለግጥም ከግጥም ለግጥም ለግጥም
ከግጥም ለግጥም

የግጥም ለግጥም
ከግጥም ለግጥም ከግጥም ለግጥም
የግጥም ለግጥም ለግጥም ለግጥም
የግጥም ለግጥም ለግጥም ለግጥም
የግጥም ለግጥም ለግጥም ለግጥም
የግጥም ለግጥም ለግጥም ለግጥም
የግጥም ለግጥም ለግጥም ለግጥም
የግጥም ለግጥም ለግጥም ለግጥም
የግጥም ለግጥም ለግጥም ለግጥም
የግጥም ለግጥም ለግጥም ለግጥም

...
ተ...
...
ደ...
...
ደ...
...
ደ...
...
.....

ወይን-ሥራዊት-ሥራዊት-ሥራዊት

ሥ...
...
...
...

ሆ...
...
ሥ...
...
ሆ...
...
ደ...
...
ደ...

ጊት-ጊት ረገድ ሰጠው ሰጠው ተ-ገድ
 ተ-ገድ ገደብ ገደብ ገደብ ገደብ
ገት-ገድ ገደብ ገደብ ገደብ ገደብ ገደብ
 ገደብ ገደብ ገደብ ገደብ ገደብ ገደብ
ገት-ገድ ገደብ ገደብ ገደብ ገደብ ገደብ
 ገደብ ገደብ ገደብ ገደብ ገደብ ገደብ
ገት-ገድ ገደብ ገደብ ገደብ ገደብ ገደብ
 ገደብ ገደብ ገደብ ገደብ ገደብ ገደብ
ገት-ገድ ገደብ ገደብ ገደብ ገደብ ገደብ
 ገደብ ገደብ ገደብ ገደብ ገደብ ገደብ
ገት-ገድ ገደብ ገደብ ገደብ ገደብ ገደብ
 ገደብ ገደብ ገደብ ገደብ ገደብ ገደብ
ገት-ገድ ገደብ ገደብ ገደብ ገደብ ገደብ
 ገደብ ገደብ ገደብ ገደብ ገደብ ገደብ
ገት-ገድ ገደብ ገደብ ገደብ ገደብ ገደብ
 ገደብ ገደብ ገደብ ገደብ ገደብ ገደብ

ተተገቱ ሁሉንም ተቀብሎ ገብሮት
የተባሉት ስም ይሁን ሁሉንም
ሁሉንም ይሁን ሁሉንም ተቀብሎ
የተባሉት ስም ይሁን ሁሉንም
የተባሉት ስም ይሁን ሁሉንም
የተባሉት ስም ይሁን ሁሉንም

ፊርማ ስም

ገ

ሀሁሉንም ተቀብሎ ሁሉንም
ተቀብሎ ሁሉንም ተቀብሎ
የተባሉት ስም ይሁን ሁሉንም
የተባሉት ስም ይሁን ሁሉንም
የተባሉት ስም ይሁን ሁሉንም
የተባሉት ስም ይሁን ሁሉንም
የተባሉት ስም ይሁን ሁሉንም
የተባሉት ስም ይሁን ሁሉንም
የተባሉት ስም ይሁን ሁሉንም
የተባሉት ስም ይሁን ሁሉንም

Բնիւնս հաւ լին ին յի յիւ
լուսնի մն ինսն ինսն յիւ
Վիսնիս լիս ինսն ինսն ինսն
լուսնի ինսն ինսն ինսն ինսն
Դիսնիս ինսն ինսն ինսն ինսն
լուսնի ինսն ինսն ինսն ինսն
Զիսնիս ինսն ինսն ինսն ինսն
լուսնի ինսն ինսն ինսն ինսն
Ըիսնիս ինսն ինսն ինսն ինսն
լուսնի ինսն ինսն ինսն ինսն
Թիսնիս ինսն ինսն ինսն ինսն
լուսնի ինսն ինսն ինսն ինսն
Կիսնիս ինսն ինսն ինսն ինսն
լուսնի ինսն ինսն ինսն ինսն
Շիսնիս ինսն ինսն ինսն ինսն
լուսնի ինսն ինսն ինսն ինսն
Չիսնիս ինսն ինսն ինսն ինսն
լուսնի ինսն ինսն ինսն ինսն
Պիսնիս ինսն ինսն ինսն ինսն
լուսնի ինսն ինսն ինսն ինսն
Պիսնիս ինսն ինսն ինսն ինսն
լուսնի ինսն ինսն ինսն ինսն
Պիսնիս ինսն ինսն ինսն ինսն
լուսնի ինսն ինսն ինսն ինսն
Պիսնիս ինսն ինսն ինսն ինսն
լուսնի ինսն ինսն ինսն ինսն

...ስት... ናት ተረፈች ገሰሰ ስትረፈው
ባላት ገሰ ገሰ ስትረፈች ገሰሰ ስትረፈው
 ስትረፈው ስትረፈው ስትረፈው
ቀላት ስትረፈው ስትረፈው ስትረፈው
 ስትረፈው ስትረፈው ስትረፈው
ቀላት ስትረፈው ስትረፈው ስትረፈው
 ስትረፈው ስትረፈው ስትረፈው
ቀላት ስትረፈው ስትረፈው ስትረፈው
 ስትረፈው ስትረፈው ስትረፈው
ቀላት ስትረፈው ስትረፈው ስትረፈው
 ስትረፈው ስትረፈው ስትረፈው
ቀላት ስትረፈው ስትረፈው ስትረፈው
 ስትረፈው ስትረፈው ስትረፈው
ቀላት ስትረፈው ስትረፈው ስትረፈው
 ስትረፈው ስትረፈው ስትረፈው

ፈተረሰት ስትረፈው

ቀላት ስትረፈው ስትረፈው ስትረፈው
 ስትረፈው ስትረፈው ስትረፈው
ቀላት ስትረፈው ስትረፈው ስትረፈው
 ስትረፈው ስትረፈው ስትረፈው
ቀላት ስትረፈው ስትረፈው ስትረፈው
 ስትረፈው ስትረፈው ስትረፈው
ቀላት ስትረፈው ስትረፈው ስትረፈው
 ስትረፈው ስትረፈው ስትረፈው
ቀላት ስትረፈው ስትረፈው ስትረፈው
 ስትረፈው ስትረፈው ስትረፈው

ገላይ ለገላውያን ለገላውያን ለገላውያን
ገላውያን ለገላውያን ለገላውያን ለገላውያን
ገላውያን ለገላውያን ለገላውያን ለገላውያን
ገላውያን ለገላውያን ለገላውያን ለገላውያን
ገላውያን ለገላውያን ለገላውያን ለገላውያን
ገላውያን ለገላውያን ለገላውያን ለገላውያን
ገላውያን ለገላውያን ለገላውያን ለገላውያን
ገላውያን ለገላውያን ለገላውያን ለገላውያን
ገላውያን ለገላውያን ለገላውያን ለገላውያን
ገላውያን ለገላውያን ለገላውያን ለገላውያን
ገላውያን ለገላውያን ለገላውያን ለገላውያን

ቅዱሳን ሙስ ለክ ሰጠው ወይ
ቀዳሽ ሁሉን ትኩረት ለሁሉ ገብሮ
ሁሉን ገብሮ ሁሉን ገብሮ ገብሮ

ፈጠራ ስራ

ቀዳሽ ሁሉን ገብሮ ሁሉን ገብሮ ገብሮ
ወይ ሁሉን ገብሮ ገብሮ ገብሮ

ሀ ሁሉን ገብሮ ሁሉን ገብሮ ገብሮ
ሁሉን ገብሮ ሁሉን ገብሮ ገብሮ

ቀ ሁሉን ገብሮ ሁሉን ገብሮ ገብሮ
ሁሉን ገብሮ ሁሉን ገብሮ ገብሮ

ገ ሁሉን ገብሮ ሁሉን ገብሮ ገብሮ
ሁሉን ገብሮ ሁሉን ገብሮ ገብሮ

ገ ሁሉን ገብሮ ሁሉን ገብሮ ገብሮ
ሁሉን ገብሮ ሁሉን ገብሮ ገብሮ

ገ ሁሉን ገብሮ ሁሉን ገብሮ ገብሮ
ሁሉን ገብሮ ሁሉን ገብሮ ገብሮ

ገ ሁሉን ገብሮ ሁሉን ገብሮ ገብሮ
ሁሉን ገብሮ ሁሉን ገብሮ ገብሮ

ቀ ሁሉን ገብሮ ሁሉን ገብሮ ገብሮ
ሁሉን ገብሮ ሁሉን ገብሮ ገብሮ

Կո ղեւոյնի կըլի և Բիւննի
ճոյն լոսնի Ինիւրիսն ճոննի
Ին Երեւոյն Բիւննի սոսն ալի
Իսկ ղի և Իս ղոյն լոսնի սոսն
Հեր Եր Գճոնն Եր Եր Եր Եր
Գոսն Եր Եր Եր Եր Եր Եր
Տո Եր Եր Եր Եր Եր Եր Եր
Եր Եր Եր Եր Եր Եր Եր Եր
Բի Եր Եր Եր Եր Եր Եր Եր
Եր Եր Եր Եր Եր Եր Եր Եր
Շի Եր Եր Եր Եր Եր Եր Եր
Եր Եր Եր Եր Եր Եր Եր Եր
Պի Եր Եր Եր Եր Եր Եր Եր
Եր Եր Եր Եր Եր Եր Եր Եր
Րի Եր Եր Եր Եր Եր Եր Եր
Եր Եր Եր Եր Եր Եր Եր Եր
Սի Եր Եր Եր Եր Եր Եր Եր
Եր Եր Եր Եր Եր Եր Եր Եր
Տի Եր Եր Եր Եր Եր Եր Եր
Եր Եր Եր Եր Եր Եր Եր Եր
Շի Եր Եր Եր Եր Եր Եր Եր
Եր Եր Եր Եր Եր Եր Եր Եր

Բ

ኃኑ ናኑ ገኑህ ተተሮ ጥረት ዘሉ ሕግ
ናኑ ናኑ ለኑ ክብር ከተ ክብር ክብር ገኑ
.....

ፋርታ ወ ገዳሳ ሳ-ገ

ሳ-ገ ገራ ገራ ገራ ገራ ገራ ገራ ገራ
ተሰኝ ገራ

ከ—*ገራ ገራ ገራ ገራ ገራ ገራ ገራ*

ገራ ገራ ገራ ገራ ገራ ገራ ገራ

ገራ ገራ ገራ ገራ ገራ ገራ ገራ

ገራ ገራ ገራ ገራ ገራ ገራ ገራ

ገራ ገራ ገራ ገራ ገራ ገራ ገራ

ገራ ገራ ገራ ገራ ገራ ገራ ገራ

ዐ—ገራ ገራ ገራ ገራ ገራ ገራ ገራ

ገራ ገራ ገራ ገራ ገራ ገራ ገራ

ገራ ገራ ገራ ገራ ገራ ገራ ገራ

ገራ ገራ ገራ ገራ ገራ ገራ ገራ

ከ—ገራ ገራ ገራ ገራ ገራ ገራ ገራ

ገራ ገራ ገራ ገራ ገራ ገራ ገራ

ገራ ገራ ገራ ገራ ገራ ገራ ገራ

ገራ ገራ ገራ ገራ ገራ ገራ ገራ

ገራ ገራ ገራ ገራ ገራ ገራ ገራ

ԴԱԵԻ ԻՎԵՆԻԵ ԸՆԴ ԵՎ ԵՎԵՔԻԵՆ
 ԲԻ ԳՐԱՅԻ ԱՒՏՏԻԳԻՏ ԱՒՕՆԵ
 ԱՒԵՆԵՑԻ Զ ԶԳԻՏ ԵՒՏԻՕՆԵ
 ԱՆՏՏԻՆ ԵՆԵ ԵՒՍԻՏ ԵՎ ՄԵԼ
 ՕՏՏՏՏՏՏ ՄԼԳԻ ԸՆԴ ԸՒՍՏԻՆ
 ԱՆՏՏՏՏ ԳԻՍԼԻ ԳՐԱՅԻ ԶԱՏՏԻՏ
 ԳԻՆՏԵՒԵՒԻ Ն ՄԵՆԻՏ ԻՆՏՏ
 ԳԻՆՏԵՒԵՒԻ ԸՆԴԸ ԵՒՏՏԻՏ
 ՖՐԱՆԸ ԵՆԵՒԵՒԻ ԱՒԸ ԱՒՏ
 ԲԻՅՈՒ ԸՆԴ ՕՒՒՒՒՒՒՒ ԵՒԵ
 ԱՏՏՏՏՏ ԳՐԱՅԻ ԳԻՏ ԵՆԸ ԶՆԵ
 ԲԵՐԵՆԸ ՕՏՏ ԵՍՏԻՒՒՒՒ ԵՒԵ
 ԱՒ ԸՆԴՏՏՏ ԵՒՍՏՏՏ ԵՎ ՏՏԻ ԲԵՐԵ

ԲԵՆԸՑԻ ԳՐԱՅԻ

ԳՐԱՅԻ ՄԵՆՏ ԵՒՍՏ ԸՆԴՏՏՏՏ ՆԻՏ
 ԵՒՍՏՏՏ ԳՐԱՅԻ ԸՆԴ ԸՒՍՏԻՆ

ԱՒՏ ԳԻՏ ԸՆԴ ՖՐԱՆԸ ԵՒՍՏԻՒՒՒ
 ԱՒՏՏՏՏ ԸՆԴ ՖՐԱՆԸ ԸՆԴ ԵՒՍՏ
 ԻՌՏՏՏ ԵՒՍՏ ՏՏՏՏ ԸՆԴՏՏՏ
 ԵՒՍՏ ԸՆԴՏՏ ԱՒՏՏՏ ԸՆԴՏՏ

ገበየብሉት ስለተሰጠው ሆኖ ማለፍ
ገራዊ ጥራት ከጥራት ሆኖ ገደብ
ጥራት ሆኖ ከጥራት ሆኖ ሆኖ
ቀዳሽ ሆኖ ከጥራት ሆኖ ሆኖ
ጥራት ሆኖ ከጥራት ሆኖ ሆኖ
ገራዊ ጥራት ሆኖ ሆኖ ሆኖ
ጥራት ሆኖ ከጥራት ሆኖ ሆኖ
ገራዊ ጥራት ሆኖ ሆኖ ሆኖ
ጥራት ሆኖ ከጥራት ሆኖ ሆኖ
ገራዊ ጥራት ሆኖ ሆኖ ሆኖ
ጥራት ሆኖ ከጥራት ሆኖ ሆኖ
ገራዊ ጥራት ሆኖ ሆኖ ሆኖ
ጥራት ሆኖ ከጥራት ሆኖ ሆኖ
ገራዊ ጥራት ሆኖ ሆኖ ሆኖ
ጥራት ሆኖ ከጥራት ሆኖ ሆኖ
ገራዊ ጥራት ሆኖ ሆኖ ሆኖ
ጥራት ሆኖ ከጥራት ሆኖ ሆኖ
ገራዊ ጥራት ሆኖ ሆኖ ሆኖ
ጥራት ሆኖ ከጥራት ሆኖ ሆኖ

ከፊት ገጽ ስለሆነ ስለሆነ ስለሆነ
ገጽ ገጽ ገጽ ገጽ ገጽ ገጽ
ዐጽ ገጽ ገጽ ገጽ ገጽ ገጽ
ገጽ ገጽ ገጽ ገጽ ገጽ ገጽ
ገጽ ገጽ ገጽ ገጽ ገጽ ገጽ
ገጽ ገጽ ገጽ ገጽ ገጽ ገጽ
ገጽ ገጽ ገጽ ገጽ ገጽ ገጽ
ገጽ ገጽ ገጽ ገጽ ገጽ ገጽ
ገጽ ገጽ ገጽ ገጽ ገጽ ገጽ

ፊት ገጽ ገጽ ገጽ

ገጽ ገጽ ገጽ ገጽ ገጽ ገጽ
ገጽ ገጽ ገጽ ገጽ ገጽ ገጽ

ፊት ገጽ ገጽ ገጽ ገጽ ገጽ ገጽ
ገጽ ገጽ ገጽ ገጽ ገጽ ገጽ
ገጽ ገጽ ገጽ ገጽ ገጽ ገጽ
ገጽ ገጽ ገጽ ገጽ ገጽ ገጽ
ገጽ ገጽ ገጽ ገጽ ገጽ ገጽ
ገጽ ገጽ ገጽ ገጽ ገጽ ገጽ
ገጽ ገጽ ገጽ ገጽ ገጽ ገጽ
ገጽ ገጽ ገጽ ገጽ ገጽ ገጽ

ገጠ-ጊት ከገት ስጥጥት ከገረገ ገጠ-ጊት
ሃጠ-ጊት ገጠ-ጊት ገጠ-ጊት ገጠ-ጊት
ገጠ-ጊት ገጠ-ጊት ገጠ-ጊት ገጠ-ጊት
ገጠ-ጊት ገጠ-ጊት ገጠ-ጊት ገጠ-ጊት
ገጠ-ጊት ገጠ-ጊት ገጠ-ጊት ገጠ-ጊት
ገጠ-ጊት ገጠ-ጊት ገጠ-ጊት ገጠ-ጊት
ገጠ-ጊት ገጠ-ጊት ገጠ-ጊት ገጠ-ጊት
ገጠ-ጊት ገጠ-ጊት ገጠ-ጊት ገጠ-ጊት
ገጠ-ጊት ገጠ-ጊት ገጠ-ጊት ገጠ-ጊት
ገጠ-ጊት ገጠ-ጊት ገጠ-ጊት ገጠ-ጊት
ገጠ-ጊት ገጠ-ጊት ገጠ-ጊት ገጠ-ጊት
ገጠ-ጊት ገጠ-ጊት ገጠ-ጊት ገጠ-ጊት
ገጠ-ጊት ገጠ-ጊት ገጠ-ጊት ገጠ-ጊት
ገጠ-ጊት ገጠ-ጊት ገጠ-ጊት ገጠ-ጊት
ገጠ-ጊት ገጠ-ጊት ገጠ-ጊት ገጠ-ጊት

ፈጥረት ለጥረት ለጥረት ለጥረት
ጥረት ለጥረት ለጥረት ለጥረት
ፈጥረት ለጥረት ለጥረት ለጥረት
ጥረት ለጥረት ለጥረት ለጥረት
ፈጥረት ለጥረት ለጥረት ለጥረት
ጥረት ለጥረት ለጥረት ለጥረት
ፈጥረት ለጥረት ለጥረት ለጥረት
ጥረት ለጥረት ለጥረት ለጥረት
ፈጥረት ለጥረት ለጥረት ለጥረት
ጥረት ለጥረት ለጥረት ለጥረት
ፈጥረት ለጥረት ለጥረት ለጥረት
ጥረት ለጥረት ለጥረት ለጥረት
ፈጥረት ለጥረት ለጥረት ለጥረት
ጥረት ለጥረት ለጥረት ለጥረት
ፈጥረት ለጥረት ለጥረት ለጥረት
ጥረት ለጥረት ለጥረት ለጥረት
ፈጥረት ለጥረት ለጥረት ለጥረት
ጥረት ለጥረት ለጥረት ለጥረት

ዐረድ ገንዘብ ለተባብሩ ገጥሞ
 ገብሮቹ ስነ ጥናት ገንዘብ ለማድረግ
የህገ መንግሥት ገንዘብ ለማድረግ
 ለዘላቂ ጥሩ ጥሩ ጥሩ ጥሩ ጥሩ
ገንዘብ ገንዘብ ገንዘብ ገንዘብ ገንዘብ
 ገንዘብ ገንዘብ ገንዘብ ገንዘብ ገንዘብ
ገንዘብ ገንዘብ ገንዘብ ገንዘብ ገንዘብ
 ገንዘብ ገንዘብ ገንዘብ ገንዘብ ገንዘብ
ገንዘብ ገንዘብ ገንዘብ ገንዘብ ገንዘብ
 ገንዘብ ገንዘብ ገንዘብ ገንዘብ ገንዘብ
ገንዘብ ገንዘብ ገንዘብ ገንዘብ ገንዘብ
 ገንዘብ ገንዘብ ገንዘብ ገንዘብ ገንዘብ
ገንዘብ ገንዘብ ገንዘብ ገንዘብ ገንዘብ
 ገንዘብ ገንዘብ ገንዘብ ገንዘብ ገንዘብ
ገንዘብ ገንዘብ ገንዘብ ገንዘብ ገንዘብ
 ገንዘብ ገንዘብ ገንዘብ ገንዘብ ገንዘብ

Ի ճիշտեանսս զտեսնեալս ի
 զամենայնսս զպատկանսս ի
 զամենայնսս ի ինչսս ինչսս
 զամենայնսս ինչսս ինչսս
 զամենայնսս ինչսս ինչսս
 զամենայնսս ինչսս ինչսս

Ի ճիշտեանսս

Ի ճիշտեանսս զամենայնսս
Ք զամենայնսս զամենայնսս
 զամենայնսս զամենայնսս
 զամենայնսս զամենայնսս
 զամենայնսս զամենայնսս
 զամենայնսս զամենայնսս
 զամենայնսս զամենայնսս
 զամենայնսս զամենայնսս
 զամենայնսս զամենայնսս
 զամենայնսս զամենայնսս
 զամենայնսս զամենայնսս
 զամենայնսս զամենայնսս

... 4 ...

... 1 ...

2 ...

... 3 ...

4 ...

... 5 ...

6 ...

... 7 ...

8 ...

... 9 ...

10 ...

... 11 ...

12 ...

... 13 ...

14 ...

... 15 ...

16 ...

... 17 ...

18 ...

... 19 ...

20 ...

2 օգ ԵԵԻԳԵԻՆ ԿԱՐԱՆ ՕՒՐ ԴԵՒԵ ԴԵՐՈՒ
ՄԻԼ ԵՆ ԸՅ ԵԵԻԳ ԵՅՏԻ ԿՈՒՊ
2 ԵԼԵՄԻՆ ԵՍԿԱՆ ԿԱՍՈՒՄԻՆ ԸՆԴՅԵՒ
ՈՒ ԵՒՓՈՒՍՆ ԴԵՄՈՒՆԻՆ ԴԵՐՈՒՆԻՆ
4 ԿԱՆ ԴԵՄՈՒՄՓԵՂԻՆ ԵՐԱՆ ՕՒ ԵՅ ԵԵՄԵՐ
ԵՐԵՄԻՆ ԲԱՏԻՆ ՄԱԿԱՆ ԿՈՒՊԻՆ ԸՆԸՐԱՆ
4 ԿԱՆԵ ԵՆԵՒ ԿՈՒՊԻՆ ԴՈՒՄԵ ԿԱՐԱՆ
ՄՈՒՓԵ ԵՆԵՐ ԴԵՒԵ ԿՈՒՊԻՆ ԵՆԸՐԱՆ
Օ ԱՆ ԴՈՒՄԻՆ ԵՐԵՄԻՆ ԿԱՆԵ ԿԱՐԱՆ
ԴՈՒՄԵ ԴԵՒԵՄԻՆ ԿԱՆԸ ՕՒՐ ԵՍԿԱՆ
Ի ԵԼԵՄԻՆ ԵՆԸՐԱՆ ԿԱՐԱՆ ԿԱՐԱՆ
ԲԱՏԻՆ ԵՅՏԻՆ ԿԱՐԱՆ ԿԱՐԱՆԻՆ
Կ ԱՆԿՈՒՄԻՆ ԵՆԸՐԱՆ ԿԱՐԱՆԻՆ ԿԱՐԱՆ ԿԱՐԱՆ
ԵՆԸՐԱՆ ԵՅՏԻՆ ԵՆԸՐԱՆ ԿԱՐԱՆ ԿԱՐԱՆ
Կ ԵՐԵՄԻՆ ԵՅՏԻՆ ԵՆԸՐԱՆ ԿԱՐԱՆ ԿԱՐԱՆ
ԴՈՒՄԵ ԿԱՐԱՆ ԿԱՐԱՆԻՆ ԿԱՐԱՆ ԿԱՐԱՆ
Կ ԵՐԵՄԻՆ ԵՅՏԻՆ ԵՆԸՐԱՆ ԿԱՐԱՆ ԿԱՐԱՆ
ԴՈՒՄԵ ԿԱՐԱՆ ԿԱՐԱՆԻՆ ԿԱՐԱՆ ԿԱՐԱՆ
Կ ԵՐԵՄԻՆ ԵՅՏԻՆ ԵՆԸՐԱՆ ԿԱՐԱՆ ԿԱՐԱՆ
ԴՈՒՄԵ ԿԱՐԱՆ ԿԱՐԱՆԻՆ ԿԱՐԱՆ ԿԱՐԱՆ
Կ ԵՐԵՄԻՆ ԵՅՏԻՆ ԵՆԸՐԱՆ ԿԱՐԱՆ ԿԱՐԱՆ
ԴՈՒՄԵ ԿԱՐԱՆ ԿԱՐԱՆԻՆ ԿԱՐԱՆ ԿԱՐԱՆ

1. **H**oc est corpus Christi
 2. **S**anguis eius qui pro nobis
 3. **E**stis etiam in terra et in
 4. **P**rophetis et in prophetis
 5. **H**oc est corpus Christi
 6. **S**anguis eius qui pro nobis
 7. **E**stis etiam in terra et in
 8. **P**rophetis et in prophetis
 9. **H**oc est corpus Christi
 10. **S**anguis eius qui pro nobis
 11. **E**stis etiam in terra et in
 12. **P**rophetis et in prophetis
 13. **H**oc est corpus Christi
 14. **S**anguis eius qui pro nobis
 15. **E**stis etiam in terra et in
 16. **P**rophetis et in prophetis
 17. **H**oc est corpus Christi
 18. **S**anguis eius qui pro nobis
 19. **E**stis etiam in terra et in
 20. **P**rophetis et in prophetis
 21. **H**oc est corpus Christi
 22. **S**anguis eius qui pro nobis
 23. **E**stis etiam in terra et in
 24. **P**rophetis et in prophetis
 25. **H**oc est corpus Christi
 26. **S**anguis eius qui pro nobis
 27. **E**stis etiam in terra et in
 28. **P**rophetis et in prophetis
 29. **H**oc est corpus Christi
 30. **S**anguis eius qui pro nobis
 31. **E**stis etiam in terra et in
 32. **P**rophetis et in prophetis
 33. **H**oc est corpus Christi
 34. **S**anguis eius qui pro nobis
 35. **E**stis etiam in terra et in
 36. **P**rophetis et in prophetis
 37. **H**oc est corpus Christi
 38. **S**anguis eius qui pro nobis
 39. **E**stis etiam in terra et in
 40. **P**rophetis et in prophetis
 41. **H**oc est corpus Christi
 42. **S**anguis eius qui pro nobis
 43. **E**stis etiam in terra et in
 44. **P**rophetis et in prophetis
 45. **H**oc est corpus Christi
 46. **S**anguis eius qui pro nobis
 47. **E**stis etiam in terra et in
 48. **P**rophetis et in prophetis
 49. **H**oc est corpus Christi
 50. **S**anguis eius qui pro nobis
 51. **E**stis etiam in terra et in
 52. **P**rophetis et in prophetis
 53. **H**oc est corpus Christi
 54. **S**anguis eius qui pro nobis
 55. **E**stis etiam in terra et in
 56. **P**rophetis et in prophetis
 57. **H**oc est corpus Christi
 58. **S**anguis eius qui pro nobis
 59. **E**stis etiam in terra et in
 60. **P**rophetis et in prophetis
 61. **H**oc est corpus Christi
 62. **S**anguis eius qui pro nobis
 63. **E**stis etiam in terra et in
 64. **P**rophetis et in prophetis
 65. **H**oc est corpus Christi
 66. **S**anguis eius qui pro nobis
 67. **E**stis etiam in terra et in
 68. **P**rophetis et in prophetis
 69. **H**oc est corpus Christi
 70. **S**anguis eius qui pro nobis
 71. **E**stis etiam in terra et in
 72. **P**rophetis et in prophetis
 73. **H**oc est corpus Christi
 74. **S**anguis eius qui pro nobis
 75. **E**stis etiam in terra et in
 76. **P**rophetis et in prophetis
 77. **H**oc est corpus Christi
 78. **S**anguis eius qui pro nobis
 79. **E**stis etiam in terra et in
 80. **P**rophetis et in prophetis
 81. **H**oc est corpus Christi
 82. **S**anguis eius qui pro nobis
 83. **E**stis etiam in terra et in
 84. **P**rophetis et in prophetis
 85. **H**oc est corpus Christi
 86. **S**anguis eius qui pro nobis
 87. **E**stis etiam in terra et in
 88. **P**rophetis et in prophetis
 89. **H**oc est corpus Christi
 90. **S**anguis eius qui pro nobis
 91. **E**stis etiam in terra et in
 92. **P**rophetis et in prophetis
 93. **H**oc est corpus Christi
 94. **S**anguis eius qui pro nobis
 95. **E**stis etiam in terra et in
 96. **P**rophetis et in prophetis
 97. **H**oc est corpus Christi
 98. **S**anguis eius qui pro nobis
 99. **E**stis etiam in terra et in
 100. **P**rophetis et in prophetis

Handwritten text in a cursive script, likely a form of Arabic or Persian, arranged in approximately 20 horizontal lines. The text is contained within a rectangular border.

۲۰۰۱



Every opportunity

56









